

મોરબી મહાનગરપાલિકા

ચૂંટણી, વસતિ ગણતરી, વોર્ડ રચના વિભાગ ની
કલમ ૪(૧) (ખ) મુજબ ૧૭ મુદ્દાઓની માહિતી

(Pro-Active Disclosure)

કલમ ૪(૧) (ખ) મુજબ ૧૭ મુદ્દાઓની માહિતી

તા. ૧૪/૧૧/૨૦૨૫ ની સ્થિતિએ

ક્રમ નંબર	વિગત	પાના નંબર
૧	પ્રસ્તાવના	૧
૨	પ્રકરણ-૨ નિયમ સંગ્રહ-૧	૨
૩	પ્રકરણ-૩	૪
૪	પ્રકરણ-૪ (નિયમ સંગ્રહ-૩)	૫
૫	પ્રકરણ-૫ (નિયમ સંગ્રહ-૪)	૬
૬	પ્રકરણ-૬ (નિયમ સંગ્રહ-૫)	૭
૭	પ્રકરણ-૭ (નિયમ સંગ્રહ-૭)	૮
૮	પ્રકરણ-૮	૯
૯	પ્રકરણ-૯	૯
૧૦	પ્રકરણ-૧૦	૧૦
૧૧	પ્રકરણ-૧૧ (નિયમ સંગ્રહ-૧૦)	૧૨
૧૨	પ્રકરણ-૧૨ (નિયમ સંગ્રહ-૧૧)	૧૩
૧૩	પ્રકરણ-૧૩	૧૪
૧૪	પ્રકરણ-૧૪ (નિયમ સંગ્રહ-૧૩)	૧૫
૧૫	પ્રકરણ-૧૫ (નિયમ સંગ્રહ-૧૪)	૧૫
૧૬	પ્રકરણ-૧૬ (નિયમ સંગ્રહ-૧૫)	૧૫
૧૭	પ્રકરણ-૧૭ (નિયમ સંગ્રહ-૧૬)	૧૫
૧૮	પ્રકરણ-૧૮ (નિયમ સંગ્રહ-૧૭)	૧૬

પ્રસ્તાવના

મોરબી મહાનગરપાલિકા કચેરીની માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ચૂંટણી વસતિ ગણતરી, વોર્ડ રચના વિભાગ (હાલે ૨૦૧૦) ની કલમ ૪(બી) હેઠળ અત્રેના શાખામાં આવતી જાહેર સેવાની વિગતો તથા તેની પદ્ધતિઓ અને કાર્યો ની પ્રાથમિક માહિતી પ્રસિધ્ધ કરવામાં આવે છે.

પ્રકરણ-૨ (નિયમ સંગ્રહ-૧)

૧. જાહેર સત્તા મંડળનું વ્યવસ્થા તંત્ર, કાર્ય અને ફરજો

૧. જાહેરતંત્રનો ઉદ્દેશ હેતુ :- મોરબી મહાનગરપાલિકા કચેરીમાં માહિતી રાજ્ય ચૂંટણી આયોગ તથા સેન્સસ ભવન ના કાર્ય માટે માળખાકીય અને કાયદાકીય વ્યવસ્થા ઉભી કરવી.

૨. જાહેર તંત્રનું મિશન દુરદેશીપણુ(વિઝન) :- માહિતીઓ અધિકાર અધિનિયમ કાયદાની સ્થિતિએ અમલ થાય અને નાગરીકો તેનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી.

૩. જાહેર તંત્રનો ટુંકો ઇતિહાસ :- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા ક્રમાંક **NO. KV-07 OF 2025-UDUHD/COC/e-file/18/2024/5932/P Section Date 01/01/2025** થી મોરબી નગરપાલિકામાં ૮ ગામો ઉમેરી મોરબી મહાનગરપાલિકા જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકારે આર.ટી.આઈ. એક્ટ ૨૦૦૫ (માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના જાહેરનામા તા.૧૫/૦૬/૨૦૦૫ થી પ્રસિધ્ધ કર્યા મુજબ કાયદાનો તથા ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના જાહેરનામા ક્રમાંક જીએસ./૨૧/૨૦૧૦/ વીએસએસ/ ૧૦૦૫ /૨૬૬૪/ આર.ટી.આઈ સેલ તા.૨૨/૦૩/૨૦૧૦ ના ગુજરાત માહિતી અધિકાર નિયમો ૨૦૧૦ ના અમલીકરણની વ્યવસ્થા ઉભી કરવા મોરબી નગરપાલિકા સામાન્ય વહીવટ શાખામાંથી અત્રેની કચેરીના મો.મ.ન.પા./એસ્ટા/જા.નં.૩૧૬૭ તા.૦૮/૦૧/૨૦૨૫ કાર્ય સોંપણી હુકમથી ચૂંટણી, વસતિ ગણતરી, વોર્ડ રચના શાખાને અલગ કરવામાં આવેલ છે.

૪. જાહેર તંત્રની ફરજો :- (૧) આર.ટી.આઈ એક્ટને અમલ સંબંધિત નિયમો અંગે માર્ગદર્શન તેમજ સરકારશ્રીના સંબંધિત વિભાગમાં સદરહું કાયદાના સંદર્ભમાં સંપર્ક કરવો.

૫. જાહેર તંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ/કાર્યો

(૧) વસતિ ગણતરી ની માહિતી પુરી પાડવી

(૨) સેન્સસ ભવન કચેરી તરફથી વખતો વખત સોંપાયેલ કાર્યો

(૩) રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના પત્ર અન્વયે જરૂરી કામગીરી

૬. જાહેર તંત્રના રાજ્ય નિયામક કચેરી, પ્રદેશ જિલ્લો, બ્લોક વગેરે સ્તરોએ સંસ્થાગત માળખા નો આલેખ

મ્યુનિસિપલ
કમિશ્નર

ક્લાર્ક

૮. જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ :-
આંકડાકીય માહિતી આધારે ભવિષ્યમાં આયોજન થઈ શકે છે.
૯. લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પદ્ધતિઓ :-
ઉપર જણાવેલી બાબતોમાં પત્ર લખી શકે છે અથવા જાહેર જનતાના પ્રતિનિધિ મારફત અથવા બિન સરકારી સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત સુચનો મોકલી શકે છે.
૧૦. સેવા આપવાના દેખરેખ નિયંત્રણ અને જાહેર ફરીયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્ર મુદ્દો લાગુ પડતું નથી.
૧૧. મુખ્ય કચેરી અને જુદા જુદા સ્તરોએ આવેલી અન્ય કચેરીના સરનામા
ડો.આંબેડકર ભવન, મોરબી મહાનગરપાલિકા કચેરી, મોરબી
૧૨. કચેરી શરૂ થવાનો સમય :- ૧૦ :૩૦ કલાકે
કચેરી બંધ થવાનો સમય :- ૧૮ : ૧૦ કલાકે
જાહેર રજાઓ :- દરેક માસનો બીજો અને ચોથો શનિવાર, તમામ રવિવારે
અને સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ જાહેર રજાઓ

પ્રકરણ ૩(નિયમ સંગ્રહ-૨) અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

૧. હોદ્દો શાખા અધ્યક્ષશ્રી

વોર્ડ રચના, ચૂંટણી શાખા :- સરકારશ્રીની કચેરી તથા જાહેર જનતાની અરજી પરત્વે યોગ્ય પ્રત્યુત્તર આપવા.

૧. જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે કઈ કાર્યપદ્ધતિ અનુસરવામાં આવે છે.

સરકારના કામકાજના નિયમો, સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ તથા વખતો વખત થતા પરિપત્રો/ઠરાવોની સુચનાઓ મુજબની કાર્યપદ્ધતિ

૨. અગત્યની બાબતો માટે કોઈ ખાસ નિર્ણય લેવા માટેની દસ્તાવેજી કાર્યપદ્ધતિઓ/ઠરાવેલી કાર્યપદ્ધતિઓ/નિયત માપદંડો/નિયમો કયા કયા છે.? નિર્ણય લેવા માટે કયા કયા સ્તરે વિચાર કરવામાં આવે છે. :- સરકારી કામકાજ માટે નિયત થયેલ જુદા જુદા નિયમ સંગ્રહો તથા સેન્સસ એક્ટ હેઠળ ૧૯૪૮ ની જોગવાઈઓ

૩. :- નિર્ણય જનતા સુધી પહોચાડવાની કઈ વ્યવસ્થા છે ? :- વહીવટી કામગીરી જાહેર જનતાને સીધી સ્પર્શતી નથી.

૪. :- નિર્ણય લેવાની પ્રક્રિયાના જેના મંતવ્યો લેવાનાર છે તે અધિકારીઓ કયા છે.
લાગુ પડતું નથી.

૫. :- નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી કોણ છે. :- ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ એક્ટ ૧૯૪૮ ની જોગવાઈએ આધીન કાર્ય સોંપણીના હુકમો અનુસાર જે તે સત્તા સોંપાયેલ હોય તેવા અધિકારી

પ્રકરણ-૪(નિયમ સંગ્રહ-૩)
કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો સુચનાઓ, નિયમસંગ્રહ અને દફતરો

નિયત કાર્યો બનાવવા નક્કી કરેલા ધોરણો

લાગુ પડતું નથી.

પ્રકરણ-૫(નિયમ સંગ્રહ-૪)

- નીતી ઘડતર અથવા અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગત.
- ૫.૧ શું નીતિઓના ઘડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ-પરામર્શ/સહભાગિતા મેળવવા માટેની કોઈ જોગવાઈ છે ? લાગુ પડતી નથી.
-
- ૫.૨ શું નીતિઓના અમલ માટે જનતાની અથવા તેમના પ્રતિનિધિઓની સલાહ/પરામર્શ/સહભાગિતા મેળવવા માટેની કોઈ જોગવાઈ છે ? લાગુ પડતી નથી.

પ્રકરણ ૬ (નિયમ સંગ્રહ-૫)

૬.૧

જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક સરકારી દસ્તાવેજો વિશેની માહિતી આપવા નીચેના નમુનાનો ઉપયોગ કરશો. જ્યાં આ દસ્તાવેજો ઉપલબ્ધ છે તેવી જગ્યાઓ જેવી કે સચિવાલય કક્ષા, નિયામકની કચેરી કક્ષા અન્યનો પણ ઉલ્લેખ કરો.

ક્રમ નંબર	દસ્તાવેજની કક્ષા	દસ્તાવેજનું નામ અને તેની એક લીટીમાં ઓળખાણ	દસ્તાવેજ મેળવવાની કાર્યપદ્ધતિ	નીચેની વ્યક્તિ પાસે છે/તેના નિયંત્રણમાં છે.
(૧)	કચેરીએ કરેલ જાહેર કાર્ય માટે જરૂરી દસ્તાવેજો	સામાન્ય સ્થાયી હુકમો તથા ઠરવો/પરીપત્રો/કરાર	નિયત ફી ચુકવી અરજી કરવી.	મોરબી મહાનગરપાલિકા કચેરી

પ્રકરણ-૭ (નિયમ સંગ્રહ-૭)

તેના ભાગ તરીકે રચાયેલ બોર્ડ પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક

૭.૧ જાહેર તંત્રને લગતા બોર્ડ, રચાયેલ બોર્ડ પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓની વિગત

- માન્ય પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું :— ડો. આંબેડકર ભવન, મોરબી મહાનગરપાલિકા કચેરી, મોરબી
- માન્ય પ્રાપ્ત સંસ્થાનો પ્રકાર :— મોરબી મહાનગરપાલિકા કચેરી
- માન્ય પ્રાપ્ત સંસ્થાનો ટુંકો પરિચય :— ભારતના બંધારણના અનુચ્છેદ ૨૪૩ (કયુ) ની જોગવાઈ મુજબ (મહાનગરપાલિકા) ની રચના કરવામાં આવે છે.
- માન્યતા પ્રાપ્ત સંસ્થાની ભૂમિકા (સલાહકાર/સંચાલક, કાર્યકારી/અન્ય) :— મોરબી મહા નગરપાલિકા દ્વારા શહેરના ફરીયાદોના નિવારણ લાવવા તથા નીતી વિષયક નિર્ણયો લેવા.

માળખાનું અને સભ્ય બંધારણ :—

લાગુ પડતું નથી.

- મુખ્ય કચેરી અને તેની શાખાઓના સરનામા ડો. આંબેડકર ભવન, મોરબી મહાનગરપાલિકા કચેરી, મોરબી
- બેઠકોની સંખ્યા : લાગુ પડતું નથી.
- શું જનતા બેઠકોમાં ભાગ લઈ શકે છે ? : લાગુ પડતું નથી.
- શું બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે. : લાગુ પડતું નથી.
- બેઠકોની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ છે ? :— લાગુ પડતું નથી.

પ્રકરણ -૮(નિયમસંગ્રહ-૭)
જાહેર માહિતી અધિકારીઓનાં નામ, હોદ્દો અને અન્ય વિગતો
સરકારી તંત્રનું નામ : મોરબી નગરપાલિકા
જાહેર માહિતી અધિકારી

અનુ. નં.	નામ	હોદ્દો	એસ.ટી.ડી. કોડ	ફોન નંબર	ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
(૧)	શ્રી ભાવેશ એન. દોશી	શાખા અધ્યક્ષ	૦૨૮૨૨	કચેરી ૨૩૦૦૫૦ ઘર -	-	admin-mmcc-mor@ gujarat.gov.in	રૂમ નં. ૫ ડો. આંબેડકર ભવન, નગર સેવા સદન, ગાંધી ચોક, મહાનગરપાલિકા કચેરી, મોરબી

પ્રથમ અપીલ સત્તાધિકારી

અનુ. નં.	ના	હોદ્દો	એસ.ટી.ડી. કોડ	ફોન નંબર	ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
(૧)	શ્રી કુલદિપસિંહ વાળા	પ્રથમ અપીલ સત્તાધિકારી	૦૨૮૧	કચેરી ૨૪૪૪૫૦૫/ ૬/૭	-	morbimnp@gmail.com	ડો. આંબેડકર ભવન, નગર સેવા સદન, ગાંધી ચોક, મહાનગરપાલિકા કચેરી, મોરબી

પ્રકરણ ૯

નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપદ્ધતિ

- ૯.૧ જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે કાર્યપદ્ધતિ (૧) ધ ગુજરાત સેન્સસ એક્ટ હેઠળ સેવાઓ.
- ૯.૨ અગત્યની બાબતો માટે કોઈ ખાસ નિર્ણય લેવા માટેની દસ્તાવેજી કાર્યપદ્ધતિઓ ધ ગુજરાત સેન્સસ એક્ટ ૧૯૪૮ હેઠળ સેવાઓ.
- ૯.૩ નિર્ણય જનતા સુધી પહોંચાડવાની કઈ વ્યવસ્થા છે ? નિર્ણય લેવાયેલી બાબતોનું અમલીકરણ કરવામાં આવે છે. અને રજુઆત કરનારને પ્રત્યુત્તર પાઠવવામાં આવે છે. જનરલ નીતી વિષય બાબતોને સમાચારપત્રો દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવે છે.
- ૯.૪ નિર્ણય લેવાની પ્રક્રિયામાં જેના મંતવ્યો લેવાનાર છે. લાગુ પડતું નથી.
- ૯.૫ નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી કોણ છે ? લાગું પડતું નથી.
- ૯.૬ જે અગત્યની બાબતો પર જાહેર અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવે છે. તેની માહિતી અલગ રીતે નીચેના નમૂનામાં આપો. લાગું પડતું નથી.

પ્રકરણ-૧૦
અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા
(ડિરેક્ટરી)

૧૦.૧ નીચેના નમૂનામાં જિલ્લાવાર માહિતી આપો.

અનુ. નં.	નામ	હોદ્દો	એસ.ટી.ડી. કોડ	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઇલ	સરનામું
				કચેરી	ઘર			
(૧)	શ્રી ભાવેશ એન. દોશી	શાખા અધ્યક્ષ	૦૨૮૨૨	૨૩૦૦૫૦	—	—	admin-mmcc-mor@ gujarat.gov.in	રૂમ નં. ૫ ડો. આંબેડકર ભવન, નગર સેવા સદન, ગાંધી ચોક, મહાનગરપાલિકા કચેરી, મોરબી

પ્રકરણ-૧૦
અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા
(રિરેક્ટરી)

૧૦.૧ નીચેના નમૂનામાં માહિતી આપો.

અનુ. નં.	નામ	હોદ્દો	એસ.ટી.ડી. કોડ	ફોન નંબર કચેરી	ફોન નંબર ઘર	ફેક્સ	ઈ-મેઇલ	સરનામું
(૧)	શ્રી ભાવેશ એન. દોશી	શાખા અધ્યક્ષ	૦૨૮૨૨	૨૩૦૦૫૦	—	—	admin-mmcc-mor@ gujarat.gov.in	રૂમ નં. ૫ ડો. આંબેડકર ભવન, નગર સેવા સદન, ગાંધી ચોક, મહાનગરપાલિકા કચેરી, મોરબી
(૨)	શ્રી રાજદીપ કે. નાથભાવા	કલાર્ક	—	—	—	—		રૂમ નં. ૬ ડો. આંબેડકર ભવન, નગર સેવા સદન, ગાંધી ચોક, મહાનગરપાલિકા કચેરી, મોરબી

પ્રકરણ-૧૨(નિયમસંગ્રહ-૧૧)

પ્રત્યેક સંસ્થાને ફાળવાયેલ અંદાજપત્ર

તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને કરેલ ચુકવણી અંગે અહેવાલોની વિગતો

વિકાસ, નિર્માણ અને તકનિકી કાર્યો અંગે જવાબદાર જાહેર તંત્ર માટે

૧૨.૧ જુદી જુદી યોજનાઓ અન્વયે જુદી જુદી પ્રવૃત્તિઓ માટે અંદાજપત્રની વિગતોની માહિતી નીચેના નમૂનામાં આપો

અનુ. નં.	યોજનાનું નામ/સદર	પ્રવૃત્તિ	પ્રવૃત્તિ શરૂ કર્યાની તારીખ	પ્રવૃત્તિના અંતની અંદાજેલ તારીખ	મંજૂર થયેલ રકમ	છુટી કરેલ ચુકવેલ રકમ (હપ્તાની સંખ્યા)	છેલ્લા વર્ષનું ખર્ચેલું	કાર્યની ગુણવત્તા માટે ટે સંપૂર્ણપણે કામગીરી માટે જવાબદારી અર અધિકારી
-	-	-	-	-	-	-	-	-

વર્ષ ૨૦૨૪-૨૦૨૫

અન્ય જાહેર તંત્રો માટે :

અનુ. નં.	સદર	સૂચિત અંદાજપત્ર	મંજૂર થયેલ અંદાજપત્ર	છુટી કરેલ ચુકવેલ રકમ (હપ્તાની સંખ્યા)	કુલ ખર્ચ
-	-	-	-	-	-

પ્રકરણ ૧૩

સહાયકો કાર્યક્રમોનો અમલ અંગેની પદ્ધતિ

૧૩.૧ નીચેના નમૂના મુજબ માહિતી આપો.

- કાર્યક્રમ/યોજનાનું નામ
- કાર્યક્રમ/યોજનાનો સમયગાળો
- કાર્યક્રમ ઉદ્દેશ
- કાર્યક્રમના ભૌતિક અને નાણાકીય લક્ષ્યાંકો (છેલ્લા વર્ષ માટે)
- લાભાર્થીની પાત્રતા
- લાભ અંગેની પૂર્વ જરૂરિયાતો
- કાર્યક્રમનો લાભ લેવાની પદ્ધતિ
- પાત્રતા નક્કી કરવા અંગેના માપદંડો
- કાર્યક્રમમાં આપેલ લાભની વિગતો (સહાયકીની રકમ અથવા આપવામાં આવેલ અન્ય મદદ પણ દર્શાવવી)
- સહાયકી વિતરણની કાર્યપદ્ધતિ
- અરજી કયા કરવી કે અરજી કરવા માટે કચેરીમાં કોનો સંપર્ક કરવો.
- અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં)
- અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં)
- અરજીપત્રકનો નમૂનો (લાગુ પડતું હોય તો સાદા કાગળ પર અરજી કરી હોય તો અરજદારે અરજીમાં શું શું દર્શાવવું તેનો ઉલ્લેખ કરો)
- બિડાણોની યાદી (પ્રમાપણત્રો/દસ્તાવેજો)
- બિડાણોનો નમૂનો
- પ્રક્રિયાને લગતી સમસ્યાઓ અંગે કયા સંપર્ક કરવો.
- ઉપલબ્ધ નિધિની વિગતો (જિલ્લા કક્ષા, ઘટક કક્ષા વગેરે જેવા વિવિધ સ્તરોએ)

સદરહું વિભાગને
લાગુ પડતું નથી.

સદરહું વિભાગને
લાગુ પડતું નથી.

સદરહું વિભાગને
લાગુ પડતું નથી.

ક્રમ નં./કોડ	લાભાર્થીનું નામ	સહાયકીની રકમ	માતા-પિતા/વાલી	પસંદગીનો માપદંડ	સરનામું			
					જિલ્લો	શહેર	નગર/ગામ	ઘર નં.
-	-	-	-	-	-	-	-	-

- નીચેના નમૂનામાં લાભાર્થીની યાદી

રાહત માટે નીચેની માહિતી પણ આપવી

- આપેલ લાભની વિગત
- લાભોનું વિતરણ

સદરહું વિભાગને લાગુ પડતું નથી.
૧૪

પ્રકરણ ૧૪ (નિયમ સંગ્રહ ૧૩)
તેણે આપેલ રાહતો પરમિટ કે અધિકૃત મેળવાનારની વિગતો

- સદરહું વિભાગને લાગુ પડતુ નથી.

પ્રકરણ ૧૫ (નિયમ સંગ્રહ ૧૪)

કાર્યો કરવા માટે નકકી કરેલા ધોરણો

૧૫.૧ વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમો હાથ ધરવા માટે વિભાગે નકકી કરેલ ધોરણોની વિગતો આપો.

- સદરહું વિભાગને લાગુ પડતુ નથી.

પ્રકરણ ૧૬ (નિયમ સંગ્રહ ૧૫)

વીજાણુરૂપે ઉપલબ્ધ માહિતી

૧૬.૧ વીજાણુરૂપે ઉપલબ્ધ વિવિધ માહિતીની વિગતો આપો.

હાલે વિગત શુન્ય છે.

પ્રકરણ-૧૭(નિયમસંગ્રહ-૧૬)

માહિતી મેળવવા માટે નાગરીકોને ઉપલબ્ધ સવલતોની વિગતો

૧૭.૧ લોકોને માહિતી મળે તે માટે વિભાગે અપનાવેલ પદ્ધતિઓ અથવા સવલતો જેવી છે.

- કચેરી ગ્રંથાલયો
- વર્તમાનપત્રો
- પ્રદર્શનો
- નોટિસ બોર્ડ
- કચેરીમાં રેકર્ડનું નિરીક્ષણ
- દસ્તાવેજો નકલો મેળવવાની પદ્ધતિ
- ઉપલબ્ધ મુદ્રિત નિયમસંગ્રહ
- જાહેરતંત્રની વેબસાઈટ આગામી સમયમાં કરવામાં આવશે.
- જાહેરખબરનાં અન્ય સાધનો

પ્રકરણ-૧૮(નિયમસંગ્રહ-૧૭)

અન્ય ઉપયોગી માહિતી

૧૮.૧ લોકો દ્વારા પુછાતા પ્રશ્નો અને તેના જવાબો.

૧૮.૨ માહિતી મેળવવા અંગે.

- અરજીપત્રક(સંદર્ભ માટે ભરેલા અરજીપત્રકની નકલ)
- ફી
- માહિતી મેળવવા માટેની અરજી કઈ રીતે કરવી કેટલીક ટિપ્પણી
- માહિતી આપવાનો ઈન્કાર કરવામાં આવે તેવા વખતે નાગરિકના અધિકાર અને અપીલ કરવાની કાર્યવાહી